

# પૂર્વરંગ

(હરિગીત)

ધ્રુવ, અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને  
વંદી કહું શુતકેવળી-ભાષિત આ સમયપ્રાભૂત અહો! ૧.

જીવ ચરિત-દર્શન-જ્ઞાનસ્�િત સ્વસમય નિશ્ચય જાણવો;  
સ્થિત કર્મપુદ્ગલના પ્રદેશો પરસમય જીવ જાણવો. ૨.

એકત્વનિશ્ચય-ગત સમય સર્વત્ર સુંદર લોકમાં;  
તેથી બને વિભવાટિની બંધનકથા એકત્વમાં. ૩.

શુત-પરિચિત-અનુભૂત સર્વને કામભોગબંધનની કથા;  
પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભ ના. ૪.

દર્શાવું એક વિભક્ત એ, આત્મા તણા નિજ વિભવથી;  
દર્શાવું તો કરજો પ્રમાણ, ન દોષ ગ્રહ સ્ખલના યદિ. ૫.

નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી જે એક શાયક ભાવ છે,  
એ રીત 'શુદ્ધ' કથાય, ને જે શાત તે તો તે જ છે. ૬.

ચારિત્ર, દર્શન, જ્ઞાન પણ વ્યવહાર-કથને જ્ઞાનીને;  
ચારિત્ર નહિ, દર્શન નહીં, નહિ જ્ઞાન, શાયક શુદ્ધ છે. ૭.

૨ ]

[ શાખ-સ્વાધ્યાય

ભાષા અનાર્ય વિના ન સમજાવી શકાય અનાર્યને,  
યવહાર વિષા પરમાર્થનો ઉપદેશ એમ અશક્ય છે. ૮.

શુતથી ખરે જે શુદ્ધ કેવળ જાણતો આ આત્મને,  
લોકપ્રદીપકરા ઋષિ શુતકેવળી તેને કહે. ૯.

શુતજ્ઞાન સૌ જાણો, જિનો શુતકેવળી તેને કહે;  
સૌ જ્ઞાન આત્મા હોઈને શુતકેવળી તેથી ઠરે. ૧૦.

યવહારનય અભૂતાર્થ દર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે;  
ભૂતાર્થને આશ્રિત જીવ સુદૃષ્ટિ નિશ્ચય હોય છે. ૧૧.

દેખે પરમ જે ભાવ તેને શુદ્ધનય જ્ઞાતવ્ય છે;  
અપરમ ભાવે સ્થિતને યવહારનો ઉપદેશ છે. ૧૨.

ભૂતાર્થથી જાણોલ જીવ, અજીવ, વળી પુરુષ, પાપ ને  
આસરવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ તે સમ્યક્તવ છે. ૧૩.

અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય ને જે નિયત દેખે આત્મને,  
અવિશેષ, અણસંયુક્ત, તેને શુદ્ધનય તું જાણજે. ૧૪.

અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય, જે અવિશેષ દેખે આત્મને,  
તે દ્રવ્ય તેમ જ ભાવ જિનશાસન સકલ દેખે ખરે. ૧૫.

દર્શન, વળી નિત જ્ઞાન ને ચારિત્ર સાધુ સેવવાં;  
પણ એ ત્રણો આત્મા જ કેવળ જાણ નિશ્ચયદેખિમાં. ૧૬.

જ્યમ પુરુષ કોઈ નૃપતિને જાણો, પછી શ્રદ્ધા કરે,  
પછી યતથી ધન-અર્થી એ અનુચરણ નૃપતિનું કરે; ૧૭.

જીવરાજ એમ જ જાણવો, વળી શ્રદ્ધવો પણ એ રીતે,  
એનું જ કરવું અનુચરણ પછી યતથી મોક્ષાર્થીએ. ૧૮.

શ્રી સમયસાર-પદ્ધાનુવાદ ]

[ ૩

નોકર્મ-કર્મ ‘હું’, હુંમાં વળી ‘કર્મ ને નોકર્મ છે’,  
—એ બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે. ૧૯.

હું આ અને આ હું, હું છું આનો અને છે મારું આ,  
જે અન્ય કો પરદવ્ય મિશ્ર, સચિત અગર અચિત વા; ૨૦.

હતું મારું આ પૂર્વે, હું પણ આનો હતો ગતકાળમાં,  
વળી આ થશે મારું અને આનો હું થઈશ ભવિષ્યમાં; ૨૧.

અયથાર્થ આત્મવિકલ્પ આવો, જીવ સંમૂહ આયરે;  
ભૂતાર્થને જાણેલ જ્ઞાની એ વિકલ્પ નહીં કરે. ૨૨.

અજ્ઞાનથી મોહિતમતિ બહુભાવસંયુત જીવ જે,  
'આ બદ્ધ તેમ અબદ્ધ પુદ્ગલદવ્ય મારું' તે કહે. ૨૩.

સર્વજ્ઞાન વિષે સદા ઉપયોગલક્ષણ જીવ જે,  
તે કેમ પુદ્ગલ થઈ શકે કે 'મારું આ' તું કહે અરે? ૨૪.

જો જીવ પુદ્ગલ થાય, પામે પુદ્ગલો જીવત્વને,  
તું તો જ એમ કહી શકે 'આ મારું પુદ્ગલદવ્ય છે'. ૨૫.

જો જીવ હોય ન દેહ તો આચાર્ય-તીર્થકર તણી  
સુતિ સૌ ઠરે મિથ્યા જ, તેથી એકતા જીવ-દેહની! ૨૬.

જીવ-દેહ બસે એક છે—વ્યવહારનયનું વચ્ચેન આ;  
પણ નિશ્ચયે તો જીવ-દેહ કદાપિ એક પદાર્થ ના. ૨૭.

જીવથી જુદા પુદ્ગલમયી આ દેહને સત્ત્વીને મુનિ;  
માને પ્રભુ કેવળી તણું વંદન થયું, સત્ત્વના થઈ. ૨૮.

પણ નિશ્ચયે નથી યોગ્ય એ, નહિ દેહગુણ કેવળી તણા;  
જે કેવળીગુણને સત્ત્વે પરમાર્થ કેવળી તે સત્ત્વે. ૨૯.

૪ ]

[ શાખ-સ્વાધ્યાય

- વર્ણન કર્યે નગરી તણું નહિ થાય વર્ણન ભૂપનું,  
ક્રીધે શરીરગુણની સુતિ નહિ સ્તવન કેવળીગુણનું. ૩૦.
- જીતી ઈન્દ્રિયો જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્મને,  
નિશ્ચય વિષે સ્થિત સાધુઓ ભાખે જિતેન્દ્રિય તેહને. ૩૧.
- જીતી મોહ જ્ઞાનસ્વભાવથી છે અધિક જાણે આત્મને,  
પરમાર્થના વિજ્ઞાયકો તે સાધુ જિતમોહી કહે. ૩૨.
- જિતમોહ સાધુ તણો વળી ક્ષય મોહ જ્યારે થાય છે,  
નિશ્ચયવિદો થકી તેહને ક્ષીણમોહ નામ કથાય છે. ૩૩.
- સૌ ભાવને પર જાણીને પચખાણ ભાવોનું કરે,  
તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાપ્યાન છે. ૩૪.
- આ પારકું એમ જાણીને પરદ્રવ્યને કો નર તજે,  
ત્યમ પારકા સૌ જાણીને પરભાવ જ્ઞાની પરિત્યજે. ૩૫.
- નથી મોહ તે મારો કંઈ, ઉપયોગ કેવળ એક હું,  
—એ જ્ઞાનને, જ્ઞાયક સમયના મોહનિર્ભર્મતા કહે. ૩૬.
- ધર્માદિ તે મારાં નથી, ઉપયોગ કેવળ એક હું,  
—એ જ્ઞાનને, જ્ઞાયક સમયના ધર્મનિર્ભર્મતા કહે. ૩૭.
- હું એક, શુદ્ધ, સદ્ગુરૂ, જ્ઞાનદર્શનમય ખરે;  
કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે! ૩૮.